

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૩/૩/૨૦૧૫ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૪૨/૧૫

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૩ કેસ કરી ૨૯ વ્યક્તિઓને ઝડપી, ૮૯ લીટર દેશી દારૂ, ૪૫૦ બોટલ ઈંગ્લીશ દારૂ, ૭૩૪ ક્વોટર ઈંગ્લીશ દારૂ, ૩૩૯ બિયર ટીન, ૦૧ મોટર સાયકલ અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૩ કેસ કરી ૦૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪,૦૬,૮૧૫/- અને જુગારનાં સાધનો કબજે કર્યાં હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૪૩/૧૫

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૯૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૧૦ વ્યક્તિઓની અને અટકાયત કરી હતી.

ખુન/લુંટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૪૪૪/૧૫

વટવા: મહેન્દ્રભાઈ ત્રીકમદાસ રંગવાણી (ઉ.વ.૫૪) (રહે. ધનલક્ષ્મી સોસાયટી સ્વપ્નસંકેત સોસાયટી ડેરીયાપરા વટવા) એ વટવા પોલીસ સમક્ષ ફરીયાદ નોંધાવી છે કે તા.૨/૩/૧૫ બપોરના ૪/૩૦ થી રાતના ૯/૩૦ વાગ્યા દરમિયાન અજાણી વ્યક્તિ પોતાના ઘરમાં પ્રવેશ કરી મહેન્દ્રભાઈની પત્ની નિશાબહેન (ઉ.વ.૪૨) ને ગળાના ભાગે અને માથાના કપાળના ભાગે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી પહેરેલ સોનાની ચેઈન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- અને સોનાની કડીઓ નંગ-૨ કિંમત રૂપિયા ૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૬,૦૦૦/- મતાની લુંટ કરી નાસી ગયા છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી જ.એચ.સરવૈયાચલાવે છે.

છેતરપીંડી -

સમાચાર યાદી નં.૪૪૫/૧૫

કાઈમ બ્રાન્ચ: વાલજીભાઈ ડાહ્યાભાઈ પંચાલ (ઉ.વ.૮૦) (રહે. દેશવાલી સોસાયટી, સાઈબાબા મંદિર પાસે, કેકેનગર, ઘાટલોડીયા) એ તા.૨/૩/૧૫ નારોજ કાઈમ બ્રાન્ચ ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૧/૧૫ થી ૨૭/૨/૧૫ ના સમયગાળા દરમિયાન આરોપી (૧) વિષ્ણુભાઈ વાલજીભાઈ પંચાલ (રહે. અંકિત સોસાયટી કેકેનગર રોડ, ઘાટલોડીયા) એ વાલજીભાઈની ખોટી સહીઓ કરી ફિક્સ ડીપોઝિટ તા.૯/૨/૧૫ નારોજ તોડી ૨૨ લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાસનફર કરાવી વાલજીભાઈના ખાતાની ચેકબુકની ચેક ઉપર ખોટી સહી કરી પૈસા ઉપાડી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એચ પી કરેણ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૪૪૬/૧૫

ગાયકવાડ હવેલી : રફિકભાઈ હાજીમહંમદ ફરજાજીવાલા (રહે.પીપળાવાળી ગલી, મોટા બંબા, જમાલપુર) એ તા.૨/૩/૧૫ નારોજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે તા.૦૧/૩/૧૫ સાંજના ૭/૩૦ થી રાતનાં ૮/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી તીજોરીના લોકરનું તાળુ તોડી તીજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા ૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૦૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી ડી.આઇ.સીસોદીયા ચલાવે છે.

સરદારનગર : ચંદુલાલ દયાલદાસ ગુરૂવાણી (રહે.દેવલાલી બજાર, આર્ય સમાજની બાજુમાં, કુબેરનગર) એ તા.૨/૩/૧૫ નારોજ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૨/૧૫ બપોરના ૪/૦૦ થી રાતનાં ૮/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી તીજોરીનું તાળુ તોડી તીજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૦૦,૧૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ઝેડ.એમ.સિંધી ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૪૪૭/૧૫

નવરંગપુરા : શ્રેયાંસભાઈ અનુજભાઈ જૈન (રહે.સિલ્વર પેલેસ હોસ્પિટલ સામે, સ્ટેડીયમ ચાર રસ્તા, નવરંગપુરા) એ તા.૨/૩/૧૫ નારોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે તા.૦૬/૨/૧૫ સવારના ૧૦/૩૦ થી બપોરનાં ૧/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના ખુલ્લા રૂમનાં ખુલ્લા કબાટમાંથી અજાણી વ્યક્તિ ડેલ કંપનીનું તથા એસુસ કંપનીના કુલ બે લેપટોપ કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- મતાના ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.જે.બોડાત ચલાવે છે.

એલીસબ્રીજ : કોકીલાબહેન પ્રમોદચંદ્ર શાહ (રહે.સેન્ટ્રલ બેંક ફ્લેટ, ભુદરપુરા રોડ, આંબાવાડી) એ તા.૦૨/૩/૧૫ નારોજ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે તા.૨૬/૨/૧૫ બપોરના ૪/૦૦ થી સાંજનાં ૭/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના બેડરૂમમાંથી અજાણી વ્યક્તિ એચ.પી. કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- મતાનું ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.ડી.વસાવા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર
પોલીસ કમિશનર વતી.